



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૩/૦૫/૨૦૧૯ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૮૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૨ કેસ કરી, ૪૨ વ્યક્તિઓને ઝડપી, ૩૮૮ લીટર દેશી દારૂ, ૧ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૧ બિયર ટીન, ૧ મોટર સાયકલ અને ૧ સ્કૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૨૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૮૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧ વ્યક્તિની અને પાસા હેઠળ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૮૮૯/૧૯

નારણપુરા: દિપકભાઈ નાથાભાઈ જોટાણીયા (રહે. મીત્રમીલન સોસાયટી સુખટાવરની બાજુમા મીરામ્બીકા સ્કુલ રોડ નારણપુરા) એ તા.૨૨/૦૫/૧૯ નારોજ નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૬/૫/૧૯ સાજના ૫/૩૦ વાગ્યાના સુમારે હર્ષલ પટેલના માતા કંચનબહેન પાસેથી ગાડીમાં પેટ્રોલ ભરાવવાનું કહી આરોપી હર્ષલ શાંતીલાલ પટેલ (રહે. અવધપુરી રો હાઉસ નિર્માણ ટાવર પાસે આર.સી.ટેકનીકલ રોડ ઘાટલોડીયા) રહેણાંકના પાર્કિંગમાંથી ટાટા એક્ઝ એક્સ.એમ.મોડલ ગાડી નંબર જીજે ૦૧ કેયુ ૨૪૩૪ કિમત રૂપિયા ૧૨,૯૭,૦૦૦/- લઈ જઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.એચ.રાહોડ ચલાવે છે.

સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયો:-

સમાચાર યાદી નં.૮૯૦/૧૯

માધવપુરા: દક્ષાબહેન વા/ઓ પંકજભાઈ મોદી (ઉ.વ.૫૯) (રહે. માળીની ખડકી વાડીગામ દરીયાપુર ચકલા દરીયાપુર) તા.૨૧/૦૫/૧૯ રાતના ૯/૪૫ વાગ્યાના સુમારે ઇદગાહ સર્કલ ખાતે આવેલ રૂપમ પેટ્રોલ પંપ નજીક ઉભા હતા ત્યારે એક્ટીવા ઉપર આવેલ પુરૂષ દક્ષાબહેન મોદીના ગળામાંથી સોનાની ચેઈન કિમત રૂપિયા ૪૫,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ દક્ષાબહેન મોદી એ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.ડી.બારોટ ચલાવે છે.

દાણીલીમડા: કિશોરભાઈ રાનાભાઈ પરમાર (ઉ.વ.૪૨) (રહે. કર્ણાવતીનગર સોસાયટી શાહવાડી ગામ નારોલ) તા.૦૪/૫/૧૯ કલાક ૫/૦૦ વાગ્યાના સુમારે સુરજ બેરલ માર્કેટ ચંડોળા તળાવની સામે કંપનીમા કામ કરતા હતા ત્યારે ગરમ ઓઇલ ઉડતા કિશોરભાઈના શરીર ઉપર પડતા દાઝી ગયા હતા. સારવાર માટે તેમને એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૧/૫/૧૯ રાતના ૧૦/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી વિનોદકુમાર થાવરાજી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.